

કામઢેનુ યુનિવર્સિટી, ગાંધીનગર

(ગજરાત સરકાર દ્વારા સને ૨૦૦૯ના ગજરાત અધિનિયમ ૯ હેઠળ પ્રસ્થાપિત)

બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટીંગ કામગીરી અંગેની જાહેરાત

કુલસચિવશ્રીની કચેરી, કામઢેનુ યુનિવર્સિટી, રૂમ નં. ૪૧૫, ચોથો માળ, બ્લોક-૧, વિંગ-બી, કર્મચોગી ભવન, સેક્ટર-૧૦એ, ગાંધીનગર (ફોન નં. ૦૭૯-૨૩૨૨૦૭૧૩) દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમો માટે સીક્યુરીટી ફીચર્સ સાથેની અંદાજિત ૨૦,૦૦૦ નંગ બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટીંગ કામગીરી માટે ઓફસેટ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા પ્રેસઘારકો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. બ્લેન્ક માર્કશીટ તથા બ્લેન્ક ડીઝી સર્ટિફિકેટનો નમુનો તા. ૨૪/૦૩/૨૦૨૦ સુધીમાં કચેરી કામકાજનાં દિવસો દરમિયાન (રજાના દિવસો સીવાય) અત્રેની કચેરીથી મેળવી લેવાનો રહેશે. રસ ધરાવતી પાર્ટીએ તા. ૨૭/૦૩/૨૦૨૦ (કચેરી સમય દરમિયાન) સુધીમા ટેન્ડરફોર્મ સ્પીડપોસ્ટ/રજીસ્ટર્ડ પોસ્ટ/કુરીયરથી અત્રેની કચેરીને મોકલી આપવાનુ રહેશે. ટેન્ડર ફોર્મ તથા વિગતવાર શરતો યુનિવર્સિટીની વેબસાઈટ www.ku-guj.org પરથી મેળવી શકાશે.

તા. ૦૬/૦૩/૨૦૨૦

કુલસચિવ

કુલસચિવશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર

ટેન્ડર ફોર્મ

(બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટીંગના ભાવો) વર્ષ:૨૦૨૦

(૧)	સંસ્થાનું નામ	
(૨)	સંસ્થાનું સરનામું	
(૩)	સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર (શોપ એક્ટ લાયસન્સની નકલ જોડવી)	
(૪)	જીસીએસટી નંબર : (સર્ટિફિકેટની નકલ જોડવી)	
(૫)	પ્રોફેશનલ ટેક્સ નંબર: (સર્ટિફિકેટની નકલ જોડવી)	
(૬)	આવકવેરાનો પાન નંબર: (સર્ટિફિકેટની નકલ જોડવી)	
(૭)	ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર:	
(૮)	ઈ-મેઈલ એડ્રેસ:	

- પ્રિન્ટીંગ કામના ઈ-ટેન્ડરીંગ દરમિયાન ભરવાનું ભાવપત્રક

અ.નં.	પ્રિન્ટીંગ કામની વિગત	એક નંગનો ભાવ (રૂ.પૈસા.) (ટેક્સ સાથેના)
૧	બ્લેન્ક માર્કશીટ (કલર પ્રિન્ટીંગ, સિક્યુરીટી ફીચર્સ સાથે) (અંદાજીત ૨૦,૦૦૦ નંગ)	

- ઉક્ત વિગતેની બ્લેન્ક માર્કશીટ કુલસચિવશ્રીની કચેરી(કામધેનુ યુનિવર્સિટી) દ્વારા આપવામાં આવેલ નમુના મુજબની ડીઝાઇન, સિક્યુરીટી ફીચર્સ અને પેપર મુજબ જ પ્રિન્ટ કરવાનું હોવાથી તે મુજબ ભાવો ભરવા. આ ટેન્ડરમાં પસંદ પામેલ પાર્ટીને બ્લેન્ક માર્કશીટની ડીઝાઇન અત્રેથી મેળવી લેવાની રહેશે અને ફક્ત બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટીંગની જ કામગીરી કરવાની રહેશે.

ટેન્ડર ભરનાર પાર્ટી/સંસ્થાનો સહી / સિક્કો

કુલસચિવશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી,

રૂમ નં.૪૧૫, ચોથો માળ, બ્લોક-૧, લિંગ-બી,

કર્મચોગી ભવન, સેક્ટર-૧૦એ, ગાંધીનગર-૩૮૨૦૧૦

બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટિંગ કામગીરી અંગેના ટેન્ડરની શરતો

૧	બ્લેન્ક માર્કશીટના પ્રિન્ટિંગ ભાવો(GST સહિતના) અલગ અલગ આપવાના રહેશે. GST ની ટકાવારી(%) અલગથી દર્શાવવાની રહેશે.
૨	જે પોતાનો પ્રેસ ફોર કલર મશીન ધરાવતા હોય અને સિક્યુરીટી ફીચર્સ ધરાવતી બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટિંગ કરવાની હોવાથી સિક્યુરીટી ફીચર્સ પ્રિન્ટિંગ કામગીરી કરતી પાર્ટીઓએ જ ટેન્ડર ભરવું.
૩	ટેન્ડર ફક્ત રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ/કુરીયર થી જ મોકલવાના રહેશે. જાહેરાતમાં દર્શાવેલ નિયત સમયમર્યાદા બાદ મળેલ તથા રૂબરૂ મળેલ ટેન્ડર માન્ય રહેશે નહીં.
૪.	બ્લેન્ક માર્કશીટ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવેલ નમુના મુજબ જ પ્રિન્ટ કરવાની રહેશે. જો તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાશે તો તે પ્રિન્ટેડ બ્લેન્ક માર્કશીટનો જથ્થો સ્વીકારવામાં આવશે નહીં અને તે અંગેનું કોઈ પણ પ્રકારનું ચુકવણું અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે નહીં.
૫	બ્લેન્ક માર્કશીટનું સેમ્પલ મંજૂર કર્યા બાદ જ પ્રિન્ટિંગની કામગીરી હાથ ધરવાની રહેશે.
૬	સૌથી ઓછા ભાવ ભરનાર/પસંદ થયેલ પાર્ટીને વર્કઓર્ડર મળ્યેથી બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટિંગ માટેની ડીઝાઇન(.CDR ફોર્મેટમાં) અત્રેથી મેળવી લેવાની રહેશે.
૭	ભાવપત્રક પર તથા જાહેરાતની શરતો પર અધિકૃત વ્યક્તિએ સહી-સિક્કા કરવાના રહેશે.
૮	વર્ક ઓર્ડરમાં દર્શાવેલ સમયમર્યાદામાં જ કામગીરી પૂર્ણ કરવાની રહેશે તથા તૈયાર થયેલ પ્રિન્ટિંગનો જથ્થો પાર્ટીએ પોતાના ખર્ચે અત્રેની કચેરી ખાતે સહી સલામત હાલતમાં પહોંચતો કરવાનો રહેશે.
૯	આ જાહેરાત બાબતે કોઈ વિવાદ થાય તે સંજોગોમાં આખરી નિર્ણય લેવાની સત્તા કામધેનુ યુનિવર્સિટીની રહેશે.
૧૦	બીલમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ટેક્સ કપાત કરવામાં આવશે.
૧૧	સરકારશ્રી કે અન્ય સંસ્થાઓ તરફથી બ્લેકલીસ્ટ કરવામાં આવેલ વેપારી પોતે કે તેના કોઈપણ ભાગીદારો કોઈપણ નામે કે સ્વરૂપે ટેન્ડર અત્રે મોકલી શકશે નહીં. અને જો ભરશે તો તે અમાન્ય ગણાશે. આવી જાણ પાછળથી પણ થશે તો કરાવેલ કામ અંગેના નાણા ચુકવવામાં આવશે નહીં તથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની કામગીરી ગોપનીય હોવાથી બ્લેન્ક માર્કશીટનો અન્ય ઉપયોગ ન થાય, તેની તકેદારી રાખવાની રહેશે તથા માર્કશીટનો દુરુપયોગ ન થાય, તેની નિયમોનુસારનાં સ્ટેમ્પ પેપર પર બાહેધરી આપવાની રહેશે.

૧૨	આવેલ ટેન્ડરો પૈકી કોઈપણ અથવા બધા ટેન્ડરો સ્વીકારવાની અગર નહી સ્વીકારવાની સત્તા કોઈપણ કારણ દર્શાવ્યા સિવાય કામઘેનુ યુનિવર્સિટીને અબાધિત રહેશે.
૧૩	ન્યાયિક બાબતો માટેનુ કાર્યક્ષેત્ર ગાંધીનગર રહેશે.
૧૪	જે પાર્ટીના ભાવ માન્ય રહેથી વર્ક ઓર્ડરની કુલ રકમનાં ૫% સિક્યુરીટી ડીપોઝીટ "KAMDHENU UNIVERSITY" ના નામની ફિક્સ ડીપોઝીટ તરીકે અત્રે જમા કરાવવાની રહેશે.
૧૫	ટેન્ડર ફી રૂ.૧,૫૦૦/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ "KAMDHENU UNIVERSITY FUND ACCOUNT" ના નામનો ટેન્ડર સાથે અચૂક જમા કરાવવાનો રહેશે. જે રકમ પરત મળવાપાત્ર નથી.
૧૬	જાહેરાતમાં દર્શાવેલ બ્લેન્ક માર્કશીટ પ્રિન્ટીંગની સંખ્યા અંદાજીત છે. જે સંખ્યામાં વધારો-ઘટાડો થઈ શકે છે.

ઉપરોક્ત તમામ શરતો મેં/અમે વાંચી છે અને હું/અમો ઉક્ત શરતોને આધીન કામ કરી આપવા માટે બંધાઉં છું/બંધાઈએ છીએ.

ટેન્ડર ભરનાર પાર્ટી/સંસ્થાનો સહી / સિક્કો